

રાજકોટ મહાનગરપાલિકા


ડો. આંબેડકર લવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧


-: અખબારી યાદી:-

# ભારે વરસાદ દરમ્યાન અને પછી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી

તારીખ: ૧૪-૦૯-૨૦૨૧







### વોર્ડ નં. ૦૧

ગઈકાલ રાજકોટ શહેરમાં આવેલ ભારે વરસાદના પગલે વોર્ડ નુ. ૧માં ચાલુ વરસાદે અને વરસાદના વિરામ બાદ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં સફાઈ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી વરસાદના પાણીનો અવિતર નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

### વોર્ડ નં. ૦૨

ગાયત્રીધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં ત્યાં નડતર રૂપ દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ , રામેશ્વર ચોક પાસેના વોકળાની સ્ક્રિન ચેમ્બર સફાઈ કરાવેલ , કાશી વિશ્વનાથ પ્લોટ પાસે તથા જકાત નાકા હોકર્સ ઝોન પાસે મેન હોલ સફાઈ કરીને પાણી નિકાલ કરાવેલ, સુભાષ નગર શેરી નંબર ૮/અ પાસે દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ.

શિતલ પાર્ક ૨ પાસે દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ.

### વોર્ડ ૦૩

ચાલુ વરસાદ દરમ્યાન ગંભીર અકસ્માત તેમજ જાનહાની ટાળવા માટે પોપટપરા નાલા તેમજ રેલનગર અંડરબ્રિજ પોલીસ ડીપાર્ટમેન્ટની સહાયથી બેરીગેટિંગ કરાવી રસ્તો બંધ કરાવેલ. ચાલુ વરસાદ માં વોર્ડ માં અલગ અલગ વિસ્તારમાથી પસાર થતા નાલા માથી પાણીના યોગ્ય નિકાલ માટે વોકળા ટીમ દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવેલ. માધાપર ચોકડી બસ સ્ટેશન પાસે જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવેલ. ગાયત્રીધામ સોસાયટી પાસે સત્યમ શિવમ સુન્દરમ પાસે ભરાયેલ પાણીનું પ્લોટની દીવાલ તોડી નિકાલ કરવામાં આવેલ. જંકશન મેઈન રોડ તેમજ હંસરાજનગર મેઈન રોડ પર નડતરરૂપ સ્પીડ બ્રેકર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવેલ. આજી નદીના કિનારે આવેલ નરસંગ પર તેમજ રૂખડિયા પરના નિયાણ વાળા વિસ્તારમાં વોર્ડ ટીમ તેમજ પોલીસ સ્ટાફ સાથે લોકોની સલામતી માટે નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા કરાવેલ તેમજ લોકોના સહેલાઈથી સ્થળાંતર માટે સીટી બસની વ્યવસ્થા પણ કરાવેલ. SWM ટીમ દ્વારા ચાલુ વરસાદ દરમ્યાન સતત એલર્ટ મોડ પર રહી પાણીના ઝડપી નિકાલ માટે અલગ અલગ વિસ્તારોમાં સ્ક્રીન ચેમ્બર સફાઈ ચાલુ રાખવામાં આવેલ. વોર્ડની ટેકનિકલ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના નિકાલ માટે વરસાદી પાણી ડ્રેનેજ મેનહોલની સતત સફાઈ કરવામાં આવેલ. આજ વહેલી સવારે વરસાદ બાદ વોકળા ટીમ દ્વારા પોપટ પરા નાલામાં ભરાયેલ કચરાનો નિકાલ કરવામાં આવેલ.

### વોર્ડ નં ૪

ભારે વરસાદ બાદ આજે બવાજીવાસ અને મિયાણાવાસમાંથી ૨૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જયપ્રકાશ નગર અને ખોડીયારપરા વિસ્તારમાંથી લોકોને આવશ્યક સ્થળાંતરની કામગીરી ચાલુ છે. આ કામગીરી પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સતત સફાઈ કામગીરી કરવામાં આવેલ.

### વોર્ડ નં ૫

માલધારી સોસાયટી તથા નવાગામ મેઈન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરાવેલ , વ્રજભૂમિ સોસાયટીમાં બ્લોક થયેલ સ્ક્રીન ચેમ્બર સફાઈ કરવી પાણીનો નિકાલ કરાવેલ, વલભનગર, સદગુરુ રણછોડનગર સંત કબીર રોડ પર સ્ક્રીન ચેમ્બર અને મેનહોલ સફાઈ કરાવી પાણીનો નિકાલ કરેલ.

### વોર્ડ નં. ૦૬

ભારે વરસાદને લીધે વોર્ડ નં ૦૬ના વિસ્તારોમા પાણી ભરાઈ જતાં વોર્ડ નં.૦૬ ના કોર્પોરેટરશ્રી સાથે સંકલનમા રહી વોર્ડ ઇજનેર , વોર્ડ ઓફિસર, એસ.આઈ. એસ.એસ. આઈ., તેમજ

અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવેલ જેમાં સીતારામ નગર રોડ પર પાણી ભરાઈ જતાં પાણીનો નિકાલ કરાવેલ. અંબિકા સોસાયટીમા ભરાઈ ગયેલ પાણીનો નિકાલ કરાવેલ, મનહર પરા ૬મા રસ્તા પર પડેલ મોટા ભુવાનો તવારિત મોરમ ભરી રસ્તો ચાલવા યોગ્ય બનાવેલ, શ્રમજીવી સોસાયટીમા યોગ્ય સમયે લોકોને સ્થળાંતર કરાવેલ. સંત કબીર રોડ પર ભરાયેલ પાણી નો નિકાલ કરાવેલ.

### વોર્ડ નં. ૭

ભવાની નગર , રામનાથ ઘાટ વિસ્તારમાં બાંધકામ , ફાયર અને વિજિલન્સની ટીમ દ્વારા સારી અને સમયસર પ્રતિક્રિયા કરવામાં આવેલ, ભવાની નગરમાંથી પાણીનો રસ્તો ખોલવા માટે ડિવાઇડર હટાવવામાં આવેલ તેમજ ભવાનીનગર મુખ્ય માર્ગ પર પડેલ દીવાલનો કાટમાળ દૂર કરવામાં આવેલ. રાત્રે સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પણ ફાયર સ્ટાફ અને બાંધકામ વિભાગના સ્ટાફ દ્વારા સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવેલ. મુખ્ય રસ્તા અને પાણીના નિવાસી વિસ્તાર પર SWM ટીમ દ્વારા ચેમ્બરની સફાઈ કરેલ, તેના કારણે વરસાદ નો નિકાલ સરળતાથી થઈ શકે. વિજીલન્સ શાખાના સ્ટાફના સહયોગથી સ્થળાંતર કામગીરી કરવામાં આવી.

### વોર્ડ નં. ૦૮

તા. ૧૩/૦૮/૨૦૨૧ના આવેલ વરસાદને લીધે વોર્ડના કોર્પોરેટર સાથે સંકલનમા રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફીસર, એસ.આઇ. તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામા આવેલ. જેમાં રામધામ સોસા. શેરી નં.૩મા પાણી ભરાવાથી દિવાલમા હોલ કરી પાણીનો નિકાલ કરેલ છે. અક્ષરમેઇન રોડ પર સ્પીડબ્રેકરની સાઇડ તોડી રોડ પર ભરાતુ પાણીનો નિકાલ કરાવેલ છે. ચાલુ વરસાદ દરમિયાન સતત એલર્ટ મોડ પર રહી પાણીના નિલાક માટે અલગ અલગ વિસ્તારમા સ્કિન ચેમ્બર સફાઈ ચાલુ રાખવામા આવેલ. અમિનમાર્ગના છેડે ૧૫૦ ફુટ રીંગ રોડ કોસીંગ પર મજુર દ્વારા સતત મોનિટરીંગ રાખી પાણીનો નિકાલ કરાવેલ. કોટેચા નગર-પમા આવેલ ફરીયાદ અંગે મેઇન હોલ ખોલી પાણીનો નિકાલ કરાવેલ . ૧૫૦ ફુટ રીંગ રોડ બિગ બજાર પાસે લસ્સિવાલા પાસે રોડ પર પાણી ભરાતા ચરેડી કરી પાણીનો નિકાલ કરાવેલ. વોર્ડ ના અલગ અલગ વિસ્તારમા સર્વે કરી રોડ પર પડેલ ખાડામા મોરમ અને બ્લોક નાખવાની કારમગીરી આજે ચાલુ કરાવેલ છે.

### વોર્ડ નં ૯

ભારે વરસાદનાં લીધે વોર્ડ નંબર ૯માં વોર્ડ ઓફીસરશ્રી, વોર્ડ એન્જીનીયરશ્રી, સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી તથા તમામ ટેકનીકલ એન્જીનીયરીંગ સ્ટાફ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વોર્ડનાં કોર્પોરેટરોને સાથે રાખીને વિવિધ કામગીરી કરવામાં આવેલ છે જેમાં કિષ્ના પાર્ક સોસાયટી શેરી નંબર ૩માં છેવાડાનાં મકાન રોડ લેવલ કરતાં નીચાં વાળા હોવાથી પાછળનાં બગીચામાથી

ઘરની ગટરમાં પાણી આવતા ઘરમાં પાણી ભરાયેલ તેના તાત્કાલીક નીવારણ માટે બગીચાની દીવાલ તોડીને પાણીનો નીકાલ કરેલ. ગુરુજી નગર આવાસ દીવાલનો એક ગાળો જે. સી. બી. દ્વારા તોડાવી પાણીનો નિકાલ કરેલ છે. નીલકંઠ નગર ૪, ગાંધી નગરશેરી નંબર ૮, દિપક સોસાયટી, રીધ્ધી સિદ્ધિ સોસાયટી, રૈયા ગામ ચોક વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં મેઇન હોલ ખોલાવી પાણીનો નિકાલ કરાવેલ માધવ પાર્ક સેરી નંબર ૨માં રોડ પર ચરેડો મારી પાણી નિકાલ કરાવેલ, વોર્ડમાં આવેલ નટરાજ નગર મફતીયાપરામાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘરમાં આવી જતાં તાત્કાલીક ફાયર બ્રીગેડ શાખા સાથે સંકલન કરી ડી - વોટરીંગ પંપ મુકાવેલ જે કામગીરી હાલમાં કાર્યરત છે. રૈયા રોડ, યુનીવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડ, ટેલીફોન એક્સ્ચેન્જ થી ગોપાલ ચોક, નાગરીક બેન્ક થી અક્ષર સ્કૂલ વાળો રોડ, ચંદન પાર્ક મેઇન પર આવેલ તમામ વરસાદી પાણીનાં નિકાલની ચેમ્બર સફાઈની કામગીરી ચાલુ વરસાદે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સફાઈ કામદાર મારફત કરાવેલ. તારીખ ૧૩/૯/૨૦૨૧ નાં રોજ ટોટલ ૫૯ ફરીયાદ ઓન લાઇન અને ઓફ લાઇન ડ્રેનેજ ઉભરાવાની આવેલ જેમાંથી મોટા ભાગની ફરીયાદો વરસાદ બંધ થતાં નિકાલ કરાવેલ તેમજ હાલમાં ડ્રેનેજ સફાઈની કામગીરી સફાઈની કામગીરી ચાલુ છે. આ સાથે રોડ રસ્તા રીપેરીંગની, ડ્રેનેજ લાઇન મેન્ટેનન્સની અને સફાઈની કામગીરી હાલમાં ચાલુ છે.

#### વોર્ડ નં ૧૦

ભારે વરસાદને લીધે વોર્ડ નં ૧૦ના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વોર્ડ ૧૦ કોર્પોરેટરશ્રી સાથે સંકલનમાં રહી વોર્ડ ઇજનેર , વોર્ડ ઓફિસર , એસ.આઇ. તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવેલ. જેમાં ઘનશ્યામ નગર શેરી નંબર ૨ અપાર્ટમેન્ટ એ અને બી વિન્ગમાં પાણી ભરાતા ફાયર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજનું સંકલન કરી સકશન મશીન દ્વારા પાણીનો નિકાલ કરેલ, સદગુરુનગર વોકળા કાંઠે પાણી ભરાતા ખુલ્લા પ્લોટ ચરેળા કરી માટી દૂર કરી પાણીનો નિકાલ કરેલ, રાવલ નગરમાં પાણી ભરાતા ચરેળા દ્વારા પાણીનો નિકાલ કરેલ , વામબે આવાસ યોજના પાછળ પાણી ભરાતા દિવાલમાં હોલ કરી પાણી નિકાલ કરેલ , શિવધામ સોસાયટી શેરી નંબર ૨ બંધ પાણી ગટરના મેનહોલ તાત્કાલિક સાફ કરાવી પાણી નિકાલ કરેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત ક્વાર્ટર્સને ભારે વરસાદ અનુસંધાને ખાલી કરવાની સુચના આપેલ.

#### વોર્ડ નં ૧૧

લક્ષ્મીના હોળે ઘરમાં પાણી ભરાતા હોવાથી નડતરરૂપ દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ , કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્કમાં ઘરમાં પાણી આવવાની શક્યતા હોવાથી સોસાયટીની પાછળની દિવાલ તોડી વોકડામાં પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરેલ , પાળ રોડ પર આવેલ વગળ ચોકમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હતા ત્યાં જેસીબીથી માટીના પાળા દૂર કરી ચોકનું પાણી ક્લિયર કરાવેલ, મવડી સ્મશાનની દિવાલ તૂટી ગયેલ હોવાથી નદીનું પાણી અંદર આવી જતા ફાયર બ્રિગેડને બોલાવી ૧૦ થી ૧૫ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ , મહુડી

બેઠા પુલ પર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનની બાજુમાં વેરિંગ કોટ નીકળી ગયેલ હોવાથી તાત્કાલિક બધું જ ઉપડાવીને લોકોની અવર જવર થઇ શકે તે કામગીરી કરેલ છે. પુલની રેલિંગ તૂટી ગયેલ હોવાથી હાલ અત્યારે રેલિંગ રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે.

### વોર્ડ નં ૧૨

ભારે વરસાદ ને લીધે વોર્ડ નં ૧૨ ના વિસ્તારો માં પાણી ભરાઈ જતાં મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ તેમજ વોર્ડ ૧૨ કોર્પોરેટરશ્રી મગનભાઈ સોરઠીયા, શ્રી અસ્મિતાબેન દેલવાડીયા, શ્રી મિતલબેન લાઠીયા સાથે સંકલનમાં રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફિસર, એસ.આઇ., તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવેલ. જેમાં ગોપાલપાર્ક, વિનાયક નગર, અન્ય લાગુ વિસ્તાર, તેમજ ગોપાલપાર્ક મેઇન રોડ, શિવ સાગર હોલ પાસે ઉપરવાસથી પાણી આવતું હોય, બોટલનેક વિસ્તાર હોય જેસીબી તેમજ મજૂરો દ્વારા ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરાવવામાં આવેલ. વાવડી, જયભારત નગર, વિશ્વકર્મા નગર તેમજ અન્ય નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવવાની ફરિયાદ મળતાં, રોડ પરથી ભરતી દૂર કરી, ચરેડા દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કરાવેલ. મવડી રોડ, મવડી ચોકડી, ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં સ્કિન ચેમ્બરની સફાઈ કરાવી, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવેલ.

### વોર્ડ નં. ૧૩

રાજકોટ શહેરનો મુખ્ય અવર જવર રોડ - ગોંડલ રોડ ચોકડી થી પી ડી એમ કોલેજ - જ્યાં વોર્ડ ૧૩ ની ટીમે SWM - બાંધકામ - સતત ખડે પગ રહી પાણી નિકાલ કરી વાહન વ્યવહારની અવર જવર બંધ ન થાય એ રીતે કામગીરી કરેલ છે, ગોંડલ રોડ પર આવેલ ઉમિયા મોબાઈલ પાસે વૃક્ષ પડી જવાના થોડા જ સમયમાં ગાર્ડન શાખાના કર્મચારીઓ દ્વારા તેમને ઉપાડી ગોંડલ રોડ પર ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરેલ.

### વોર્ડ નં.૧૪

લલૂડી વોકડીમા તા.૧૩/૦૯/૨૧ ના રોજ વરસાદ ના લીધે પાણી નું લેવલ ખૂબજ વધી જતા લોકોના ઘરમાં પાણી આવી ગયેલ હોય તો ફાયર બ્રિગેડ ની ટીમ, ઉચ્ચ અધિકારી ની ટીમ, પોલીસ ની ટીમ તેમજ માન.કમિશ્નર સાહેબ, વોર્ડ કોર્પોરેટ શ્રી નીલેશભાઈ જલૂ, કેતનભાઈ પટેલની ટીમ દ્વારા મદદરૂપ થઈ લોકોના બચાઉ કાર્યની કામગીરી તેમજ જમવા ની વ્યવસ્થા કરેલ હતી. હાથીખાના, જયરાજ પ્લોટ વિસ્તારમાં કાચુ બાંધકામની દિવાલ પડી ગઈ હોય જેને JCB દ્વારા દૂર કરી પાણી નિકાલ નો રસ્તો કરેલ હતો. માસ્તર સોસાયટી, વાણીયાવાડી, સોરઠીયા સર્કલ, લક્ષ્મીવાડી વિસ્તારમાં SWM ટીમ દ્વારા સ્કીનીંગ ચેમ્બરની સફાઈ કરી પાણી નિકાલનો રસ્તો કરેલ હતો. નવયુગ પરા, ધાંચીવાડ વિસ્તારો જે નદીકાંઠાની બાજુમાં હોય ત્યાં વોર્ડ કોર્પોરેટ સાથે રહીને લોકોને માઈકમાં જાણ કરીને જીલ્લા ગાર્ડન પાસે આવેલ આંબેડકર હોલમાં જરૂરિયાત મુજબ

સ્થળાંતરની કામગીરી કરેલ હતી. લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ વૉકળાની ટીમ દ્વારા વૉકળામાં તણાય આવેલ કચરાનું સફાઈ કરી પાણી નિકાલ નો રસ્તો કરેલ હતો.

#### વોર્ડ નં. ૧૫

શ્રીહરિ ઇન્ડસ્ટ્રી ખોખડદળ નદીના કાંઠે જેસીબી વડે ચરેડો કરી તેમજ નદી બાજુ પાળો કરી પાણી નિકાલ કરેલ. નેશનલ હાઇવે માટુતિ , કિશાન, ધારા ઇન્ડસ્ટ્રી જેસીબી વડે ચરેડો કરી પાણી નિકાલ કરેલ.ગંજીવાડા પીટીસી દીવાલ પાસે જેસીબી વડે ચરેડો કરી પાણી નિકાલ કરેલ. ૮૦ ફૂટ રોડ સત્યમ પાર્ક પાછપ ગટરનો કચરો દૂર કરી પાણી નિકાલ કરેલ. ૮૦ ફૂટ રોડ ફિલ્ડમાર્શલ પાસે મેનહોલ દ્વારા પાણીનો નિકાલ કરેલ.સત્યમ પાર્ક ૪ અને મનહર સોસાયટી ૭ માં મેનહોલ દ્વારા પાણીનો નિકાલ કરેલ.

#### વોર્ડ નં. ૧૬

જંગલેશ્વર સ્કૂલ નં ૭૦ માં પાણી ભરાતા જેસીબી વડે દીવાલમાં હોલ પાડી પાણી નિકાલ કરેલ. જંગલેશ્વર સ્કૂલ નં ૭૦ નજીક વોકળા પાસે પાણી ભરાતા જેસીબી વડે વોકળાના પતરા દૂર કરી પાણી નિકાલ કરેલ. એકતા કોલોની ૫ ના છેડે પાણી ભરાતા જેસીબી વડેવડે નદીના ભાગે નાખેલ ભરતીને દૂર કરી પાણી નિકાલ કરેલ. એકતા કોલોનીમાં પાણી ભરાતા અંદાજે ૨૦૦ લોકોને નજીકની સ્કૂલ નંબર ૭૦ માં સ્થળાંતર કરેલ.

#### વોર્ડ નં. ૧૭

ભારે વરસાદ કારણે ધનશ્યામ નગર શેરી નં ૫-૬ માં વરસાદી પાણીનો ભરાવો થતા બાંધકામ ડીપાર્ટમેન્ટ અને કાઉન્સેલર વિનુભાઈ ધવા(શાશક પક્ષનેતાશ્રી) , શ્રીમતી અનીતાબેન ગોસ્વામી સાથે લાઈઝન કરી ૨ પંમ્પ મુકી પાણીનો નિકાલ કરાવેલ. ગીતાજંતી સોસાયટી શેરી-૧ બંધશેરીમાં વરસાદી પાણી ભરાઈ જતા દીવાલમાં હોલ કરીને પાણીનો નિકાલ કરેલ , ખોડીયાર નગરમાં પાણી ભરાઈ જતા પાછપ ગટરની સફાઈ કરાવી પાણીનો નિકાલ કરાવેલ , પારડી રોડ, સહકાર મેઇન રોડ, હરીધવા રોડ સ્કીન ચેમ્બરની સફાઈ કરાવી વરસાદી પાણીનો નીકાલ કરાવેલ.

#### વોર્ડ નં ૧૮

કોઠારીયા ચોકડીથી અમદવાદ બાજુ નેશનલ હાઇવેની બાજુમા આવેલ વોકડામા ખુબ જ વધારે પાણી આવતા , અંદાજે ૩૦-૩૫ ઝુંપડાના રહીસોને નજીકમા આવેલ તીરૂપતી શાળામા સ્થળાંતર કરેલ છે અંદાજે ૭૦-૮૦ માણસો નું સ્થળાંતર કરવામાં આવેલ. જયરામ પાર્ક પાસે આવેલ હોકળાના કાઠાના મજુરો અને ઝુંપડપટ્ટી વાળાના અંદાજે ૫૦-૬૦ લોકો ને નજીકમા આવેલ તીરૂપતી શાળા મા સ્થળાંતર કરેલ છે . હાપલીયા પાર્કમા વરસાદી પાણી ભરાઈ જવાથી જેસીબી અને માણસોની મદદથી ચરેડા કરીને પાણીનો નિકાલ કરેલ છે , નારાયણનગરમા વરસાદી પાણી ભરાઈ જવાથી જેસીબી અને માણસોની મદદથી ચરેડા કરીને પાણીનો નિકાલ કરેલ છે ,



સાંઘબાબાસર્કલ થી કોઠારીયા રોડ સુધી પાણીના ભરાવો હોઈ , સ્ટ્રોમ વોટર ડ્રેનેજના મેનહોલની સતત સફાઈ કરાવીને પાણીનો નિકાલ કરાવેલ છે, રીધ્ધી સીધ્ધીના નાલાથી સદભાવના સોસાયટી રોડ સુધી પાણીના ભરાવો હોઈ , સ્ટ્રોમ વોટર ડ્રેનેજના મેનહોલની સતત સફાઈ કરાવીને પાણીનો નિકાલ કરાવેલ છે, કોઠારીયા ગામ મેઇન રોડ તાલુકા શાળા પાસે પાણી ભરાયેલ હોઈ, ડીવાઇડર તોડીને પાણીનો નિકાલ કરાવેલ છે. સ્વાતી પાર્ક મેઇન રોડ તાલુકા શાળા પાસે પાણી ભરાયેલ હોઈ, ડીવાઇડર તોડીને પાણીનો નિકાલ કરાવેલ છે.

(જન સંપર્ક અધિકારી)  
રાજકોટ મહાનગરપાલિકા